

EXAMINATION OCT. – 2019.

B.A.(NEW CBCS) SEM-3

PHILOSOPHY EC-2

(Logic Indian & Western – S/S)

સમય : ૨.૩૦ કલાક

Code: ૨૦૪૫૮

22 OCT 2019

કુલ ગુણ : ૭૦

પ્રશ્ન - ૧(A) વૈજ્ઞાનિક વ્યાપ્તીના વાસ્તવિક આધારો ક્યાં છે ? નિર્દેશો. ૧૪

અથવા

પ્રશ્ન - ૧(A)(i) વ્યાપ્તિ એટલે શું ? અર્થ અને સ્વરૂપનું નિરૂપણ કરો. ૦૭

પ્રશ્ન - ૧(A)(ii) કારણ એટલે શું ? અર્થ આપી મહત્વ નિર્દેશો. ૦૭

પ્રશ્ન - ૧(B) ટૂંકા પ્રશ્નો (૬ માંથી કોઈ પણ ૪નાં જવાબ એક કે બે લાઈનમાં લખો) ૦૪

૧. વ્યાપ્તીના પ્રણેતા કોણ છે ?

૨. વ્યાપ્તિ એટલે શું ? વ્યાપ્તિ શબ્દનું અર્થધટન કરો.

૩. વૈજ્ઞાનિક વ્યાપ્તીના સ્વરૂપલક્ષી આધારો કેટલા અને ક્યાં છે ? નિર્દેશો.

૪. વ્યાપ્તીના વાસ્તવિક આધારો કેટલા છે ? લખો.

૫. બેન વ્યાપ્તિની વ્યાખ્યા શું આપે છે ?

૬. સાદી ગાણનામુલક વ્યાપ્તિનું બીજું નામ શું છે ? જણાવો ?

પ્રશ્ન - ૨(A) કારણનો ભારતીય ખ્યાલ સવિગત સમજાવો. ૧૪

અથવા

પ્રશ્ન - ૨(A)(i) કારણની વૈજ્ઞાનિક સંકલ્પના કેવી છે ? સદ્ગ્રાંત દર્શાવો. ૦૭

પ્રશ્ન - ૨(A)(ii) કારણનું બંધારણ વિસ્તાર થી સમજાવો. ૦૭

પ્રશ્ન - ૨(B) ટૂંકા પ્રશ્નો (૬ માંથી કોઈ પણ ૪નાં જવાબ એક કે બે લાઈનમાં લખો) ૦૪

૧. જે.એસ.મિલ નાં મતે કારણની વ્યાખ્યા શું છે ?

૨. કારણ એટલે શું ? સ્પષ્ટ કરો.

૩. કાર્યથરીડનું કારણ અંગે મંતવ્ય જણાવો.

૪. લૌકિક ખ્યાલ પ્રમાણે કારણ એટલે શું ?

૫. કારણના ક્યાં ક્યાં પ્રકાર છે ? ઉલ્લેખો.

૬. કારણ બહુત્વ એટલે શું ?

પ્રશ્ન - ૩(A) મિલની દુરીકરણની રીતી એટલે શું ? કોઈ પણ બે ક્રાંતાંત આપી નીરૂપો. ૧૪

અથવા

પ્રશ્ન - ૩(A)(i) મિલની પદ્ધતિઓની મર્યાદાઓનો નિર્દેશ કરો. ૦૭

પ્રશ્ન - 3 (A)(ii) સાદ્રશ્ય તર્ક વ્યાપ્તિ સંબંધિત ઉલ્લેખો.	09
પ્રશ્ન - 3 (B) દ્રોગ પ્રશ્નો (૫ માંથી કોઈ પણ ત૩ નાં જવાબ એક કે બે લાઇનમાં લખો)	03
૧. સાદ્રશ્ય એટલે શું ?	
૨. સાદ્રશ્ય તર્કની કિયામાં વિચારની ગતિ કઈ તરફ થી કઈ તરફ છે ?	
૩. વ્યાપ્તિ રીતિઓ કેટલી અને કઈ કઈ છે ?	
૪. વ્યાપ્તિ રીતિઓ કોણે આપી છે ?	
૫. અન્વય રીતી એટલે શું ? વ્યાખ્યા આપો.	

પ્રશ્ન - ૪(A) દ્વીધાનુંમાન એટલે શું ? જટિલ દ્વીધાનુંમાન ઉદાહરણ આપી સમજાવો. ૧૪

અથવા

પ્રશ્ન - ૪(A)(i) સાદી શુંગાપત્તીનું સ્વરૂપ અને પ્રકારો ઉદાહરણ આપી જણાવો.	09
પ્રશ્ન - ૪(A)(ii) સ્પષ્ટીકરણનો અર્થ આપી વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણનું નિરૂપણ કરો.	09
પ્રશ્ન - ૪(B) દ્રોગ પ્રશ્નો (૫ માંથી કોઈ પણ ત૩ નાં જવાબ એક કે બે લાઇનમાં લખો)	03
૧. શુંગાનુંપત્તી ક્યાં અનુમાનનું બીજું નામ છે ?	
૨. ઉભય પાસ નું સ્વરૂપ ક્યાં અનુમાનના નિયમોને અનુસરે છે ?	
૩. દ્વીધાનુંમાનનાં પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે ?	
૪. સાદી વિધેયક તર્કાપત્તીનું ફલિત વિધાન ક્યાં પ્રકારનું છે ?	
૫. દ્વીધાનુંમાનનું ખંડન એટલે શું ?	